



VIDHYAYANA

ISSN 2454-8596

www.vidhyayanaejournal.org

An International Multidisciplinary Research e-Journal

બી. એડ. અભ્યાસક્રમના બાલ્યાવસ્થા અને વિકાસ વિષયના અભિસંધાન એકમના અધ્યાપન માટે પાવર
પોઇન્ટ પ્રેઝન્ટેશન કાર્યક્રમની અસરકારકતા

હેતલ એચ. જોષી

આસી. શિક્ષક

માતૃશી મોંદીબા ગાર્લ્સ હાઇસ્કૂલ,

વીરપુર

VIDHYAYANA

ડૉ. હિતેશ એમ. સોલંકી

અસ્સિસ્ટન્ટ પ્રોફેસર

શ્રીમતી એમ. એમ. શાહ કોલેજ ઓફ એડ્યુકેશન, વઢવાળ સિટી



VIDHYAYANA

ISSN 2454-8596

www.vidhyayanaejournal.org

An International Multidisciplinary Research e-Journal

સારાંશ

પ્રસ્તુત અભ્યાસમાટે પરપરાગત અધ્યાપન પદ્ધતિ અને પાવર પોઇન્ટ પ્રોજેક્ટેશન કાર્યક્રમની અભિસધાન એકમના અધ્યાપન માટે સરચના કરી હતી. કાર્યક્રમ સરચના અતર્ગત અભિસધાન એકમના વિષયવસ્તુનું ચાર ભાગમા વિભાગીય આયોજન કરી પરપરાગત તથા પાવર પોઇન્ટ વિડીયો કલિપ-સ્લાઈડ શો નિર્માણ કરવામા આવ્યો હતો. કાર્યક્રમ સરચના માટે કમ્પ્યુટર ટેકનોલોજી સાધનનો ઉપયોગ કરવામા આવ્યો હતો. ત્યારબાદ પ્રાયોગિક રીતે આ બને કાર્યક્રમનો અમલ શહેરી વિસ્તારની બી.એડ. કોલેજમા અભ્યાસ કરતા તાલીમાર્થીઓ પર કરવામા આવ્યો હતો. પ્રયોગના અતે શિક્ષક નિર્મિત ઉત્તર કસોટીની મદદથી મૂલ્યાકન કરવામા આવ્યું અને પ્રાપ્તાકો મેળવવામા આવ્યા હતા. બને જૂથના પ્રાપ્તાકોના સરાસરી તફાવતની સાર્થકતા ટી-કસોટી દ્વારા ચકાસવામા આવી. પરપરાગત તથા પાવર પોઇન્ટ પ્રોજેક્ટેશન કાર્યક્રમની શૈક્ષણિક સિદ્ધિ પર અસરકારકતા ચકાસવામા આવી હતી.



VIDHYAYANA



VIDHYAYANA

ISSN 2454-8596

www.vidhyayanaejournal.org

An International Multidisciplinary Research e-Journal

બી.એડ. અભ્યાસક્રમના બાલ્યાવસ્થા અને વિકાસ વિષયના અભિસધાન એકમના અધ્યાપન માટે
પાવર પોઇન્ટ પ્રોજેન્ટેશન કાર્યક્રમની અસરકારકતા

૧.૦ પ્રસ્તાવના

આજનું વિશ્વ માનવજાતના અથાગ પ્રયત્નોનું પરિણામ છ. આદિકાળથી માનવ જીવન સતત વિકસતુ રહ્યું છે. છેલ્લી બે સદીઓ અને તેમાં પણ છિલ્લા પચાસ વર્ષમાં આ વિકાસની ઝડપ અત્યત વધી છે. જેનો શ્રેય વિજ્ઞાન અને ટેક્નોલોજીના ફાળે છે.

પ્રાચીન સમયમાં ગુરુ દ્વારા શિષ્યને વ્યાખ્યાન, રટણ, ઉચ્ચારણ, પુનઃરટણ, ચર્ચા વગેરે દ્વારા શિક્ષણકાર્ય હાથ ધરવામાં આવતું હતું, પરતુ આ શિક્ષણ પદ્ધતિની કેટલીક મર્યાદાઓ હતી. સમય જતા શિક્ષણમાં વ્યાખ્યાન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો. જેમાં બ્લેકબર્ડ, ચોક અને વ્યાખ્યાનના ઉપયોગ કરવામાં આવતો પરતુ તેમાં પણ કેટલીક ખામીઓ જોવા મળે છે. કારણ કે બધા જ વિષયો માટે માત્ર વ્યાખ્યાન પદ્ધતિ જ યોગ્ય છે એવું કહી શકાય નહીં. તેમજ એક જ વિષયમાં આવતા જુદા—જુદા એકમો માટે પણ એક જ શિક્ષણ પદ્ધતિ દ્વારા અધ્યાપનમાં કેટલીક મર્યાદાઓ રહી જાય છે. તેમજ વિદ્યાર્થીઓને શિક્ષણકાર્યમાં પ્રવૃત્ત રાખવાથી શિક્ષણ પદ્ધતિને વધારે અસરકારક બનાવવી જોઈએ.

શૈક્ષણિક ટેક્નોલોજીના સમયમાં શિક્ષણ પદ્ધતિને અસરકારક બનાવવા માટે આધુનિક શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવો અનિવાર્ય બન્યો. પ્રાયોગિક એકમોના અધ્યાપન માટે આધુનિક પદ્ધતિ અસરકારક નિવઢે છે કે નહીં તે બાબતને ધ્યાનમાં રાખતા પ્રસ્તુત અભ્યાસ બી.એડ. અભ્યાસક્રમ અતર્ગત બાલ્યાવસ્થા અને વિકાસ વિષયના ‘અભિસધાન’ એકમના અધ્યાપન માટે પાવર પોઇન્ટ પ્રોજેન્ટેશન કાર્યક્રમની અસરકારકતાના સંદર્ભમાં અભ્યાસ હાથ ધર્યો હતો.



૨.૦ અભ્યાસના હેતુઓ

- પ્રસ્તુત અભ્યાસના હેતુઓ આ મુજબ હતા.
 - ૧. અભિસધાન એકમના અધ્યાપન માટે પાવર પોઇન્ટ પ્રોજેન્ટેશન કાર્યક્રમની સરચના કરવી.
 - ૨. અભિસધાન એકમના અધ્યાપન માટે પાવર પોઇન્ટ પ્રોજેન્ટેશન કાર્યક્રમની અસરકારકતા ચકાસવી.

૩.૦ અભ્યાસની ઉત્કલ્પનાઓ

પ્રસ્તુત અભ્યાસની ઉત્કલ્પના આ મુજબ હતી.

“બી.એડ. અભ્યાસક્રમ અતર્ગત બાલ્યાવસ્થા અને વિકાસ વિષયના ‘અભિસધાન’ એકમ માટે પરપરાગત અધ્યાપન પદ્ધતિથી અધ્યયન પામેલા વિદ્યાર્થીઓ અને પાવર પોઇન્ટ પ્રોજેન્ટેશન અધ્યાપન પદ્ધતિથી અધ્યયન પામેલા વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિના પ્રાપ્તાકોની સરાસરીઓ વચ્ચે સાર્થક તફાવત નહીં હોય.”



VIDHYAYANA

ISSN 2454-8596

www.vidhyayanaejournal.org

An International Multidisciplinary Research e-Journal

૪.૦ અભ્યાસમા સમાવિષ્ટ ચલો

પ્રસ્તુત અભ્યાસ સમાવિષ્ટ ચલો આ પ્રમાણે હતા.

સ્વતત્ત્ર ચલ. પ્રસ્તુત અભ્યાસમા સ્વતત્ત્ર ચલ તરીકે અધ્યાપન પદ્ધતિ જેની બે કક્ષાઓ (૧) પાવર પોઇન્ટ પ્રોજેક્ટ અને (૨) પરપરાગત અધ્યાપન પદ્ધતિ.

પરતત્ત્ર ચલ. પ્રસ્તુત અભ્યાસમા પરતત્ત્ર ચલ તરીકે શૈક્ષણિક સિદ્ધિ હતી.

અકુશિત ચલ. પ્રસ્તુત અભ્યાસમા અકુશિત ચલ તરીકે (૧) શિક્ષણનુ માધ્યમ, (૨) શૈક્ષણિક વર્ષ, (૩) એકમ, (૪) જાતીયતા, (૫) વિષય.

આતરવર્તી ચલ. પ્રસ્તુત અભ્યાસમા આતરવર્તી ચલ તરીકે (૧) અધ્યાપન પદ્ધતિનુ નાવિન્ય, (૨) જૂથો વચ્ચે થતી આતરકિયા, (૩) વિષય પ્રત્યે રસ અને (૪) વ્યક્તિગત ભિન્નતા.

૫.૦ પદોની વ્યવહારુ વ્યાખ્યા

પાવર પોઇન્ટ પ્રોજેક્ટ અને કાર્યક્રમ. આયોજનબદ્ધ વ્યાખ્યાન માટે માહિતીના મુદ્દાઓને અસરકારક રીતે રજૂ કરવા માટે પાવર પોઇન્ટ પ્રોજેક્ટ અને શિક્ષકને અધ્યાપન કાર્યમા ઉપયોગી બનતુ સાધન છે. વિદ્યાર્થીને દશ્ય-શાબ્દ સ્વરૂપમા કમ્પ્યુટર સ્લાઈડ દ્વારા માહિતી પૂરી પાડતુ સાધન જેની રજૂઆતની સાથે શિક્ષક કથન હોય તેમજ ચિત્રો, સારણી, આવેદ્યો, કોષ્ટક વગેરેની રજૂઆત કરવામા મદદરૂપ થાય છે.

શૈક્ષણિક સિદ્ધિ. બી.એડ. અભ્યાસક્રમ અતર્ગત બાલ્યાવસ્થા અને વિકાસ વિષયમા ‘અભિસધાન’ એકમ માટે રચવામા આવેલ શિક્ષક રચિત કસોટીમા તાલીમાર્થાઓએ મેળવેલ પ્રાપ્તાકોને શૈક્ષણિક સિદ્ધિ તરીકે સ્વીકારવામા આવેલ.



૬.૦ અભ્યાસન ક્ષેત્ર

પ્રસ્તુત અભ્યાસનુ ક્ષેત્ર શૈક્ષણિક ટેક્નોલોજી અને અધ્યાપન પ્રયુક્તિ હતુ.

૭.૦ અભ્યાસનો પ્રકાર

પ્રસ્તુત અભ્યાસ વ્યવહારિક પ્રકારનુ હતુ તથા પ્રસ્તુત અભ્યાસ મા માહિતી તાલીમાર્થાઓ પાસેથી સખ્યાત્મક સ્વરૂપે પ્રાપ્ત હતી, તેનુ ગુણ્ણાકન કર્યા બાદ તેનુ અકશાસ્ત્રીય પ્રયુક્તિઓનો ઉપયોગ કરી પૃથક્કરણ કરવામા આવ્યુ હતુ તેથી આ અભ્યાસ સખ્યાત્મક પ્રકારનો હતો.

૮.૦ વ્યાપવિશ્વ

પ્રસ્તુત અભ્યાસમા વ્યાપવિશ્વ તરીકે બી.એડ.ના તાલીમાર્થાઓનો સમાવેશ કરવામા આવ્યો હતો.

૯.૦ નમૂના પસદગી

પ્રસ્તુત અભ્યાસમા બી.એડ. કોલેજની પસદગી સહેતુક નમૂના પસદગીથી કરવામા આવેલ અને કોલેજના ૬૦ પાત્રોનો નમૂના તરીકે સમાવેશ કરવામા આવેલ હતો.

૧૦.૦ સશોધન પદ્ધતિ

પ્રસ્તુત અભ્યાસ પ્રાયોગિક સશોધન પદ્ધતિ દ્વારા હાથ ધરવામા આવ્યો હતો.



VIDHYAYANA

ISSN 2454-8596

www.vidhyayanaejournal.org

An International Multidisciplinary Research e-Journal

૧૧.૦ ઉપકરણ

પ્રસ્તુત અભ્યાસમા શિક્ષક નિર્મિત કસોટીનો ઉપકરણ તરીકે ઉપયોગ કરવામા આવ્યો હતો.

૧૨.૦ માહિતીનું એકત્રીકરણ

પ્રસ્તુત અભ્યાસમા પ્રાયોગિક કાર્યના અતે પરતત્ર ચલના માપન માટે બને જૂથના તાલીમાર્થીઓ પાસેથી 'અભિસધાન' એકમની શિક્ષક નિર્મિત સિદ્ધિ કસોટી દ્વારા માહિતી મેળવવામા આવી હતી.

૧૩.૦ માહિતીનું સ્વરૂપ

પ્રસ્તુત અભ્યાસનો હેતુ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન કાર્યક્રમ પદ્ધતિની અસરકારકતા તપાસવાનો હતો. આ માટે બને જૂથો પર પ્રયોગના અમલ બાદ શિક્ષક નિર્મિત કસોટી દ્વારા બને જૂથોના સિદ્ધિ પ્રાપ્તાકો કાચા પ્રાપ્તાકો સ્વરૂપે મેળવવામા આવ્યા હતા. મેળવેલ માહિતી સાખ્યાત્મક સ્વરૂપમા હતી. જેની માપન કક્ષા અતરાલ માપ પદ્ધતિ હતી.

૧૪.૦ પૃથક્કરણની પ્રવિધિ

પ્રસ્તુત અભ્યાસમા શિક્ષક નિર્મિત કસોટી પર પ્રાપ્ત થયેલ બને જૂથોના પ્રાપ્તાકોના પૃથક્કરણ માટે સરાસરી, પ્રમાણવિચલન અને ટી-મૂલ્ય મેળવવામા આવ્યા હતા.

૧૫.૦ માહિતીનું પૃથક્કરણ અને અર્થઘટન

પ્રસ્તુત અભ્યાસમા પ્રયોગ દરમિયાન પ્રાયોગિક જૂથમા રૂ. 30 અને નિયત્રિત જૂથમા પણ રૂ. 30 તાલીમાર્થીઓ હતા. આમ બને જૂથ મળીને કુલ રૂ. 60 તાલીમાર્થીઓ હતા. પ્રયોગને અતે આ રૂ. 60 તાલીમાર્થીઓને એકમ સિદ્ધિ કસોટી આપવામા આવી હતી અને તેના આધારે પ્રાપ્ત થયેલ સિદ્ધિ પ્રાપ્તાકો દ્વારા પ્રાપ્તાકોની સરાસરી, પ્રમાણવિચલન અને સરાસરીઓ વચ્ચેના તફાવતનું ટી-મૂલ્ય મેળવવામા આવ્યું હતું જે અહીં સારણી સ્વરૂપે રજૂ કરેલ છે.

સારણી-૧

પ્રાયોગિક અને નિયત્રિત જૂથોની શિક્ષક રચિત ઉત્તર કસોટીના પ્રાપ્તાકોની સરાસરી, પ્રમાણવિચલન અને ટી-મૂલ્ય

ક્રમ	જૂથ	સખ્યા	સરાસરી	પ્રમાણવિચલન	ટી-મૂલ્ય
૧	પ્રાયોગિક જૂથ	૩૦	૧૮.૮૦૦	૪.૬૨૬	૧.૬૫૦
૨	નિયત્રિત જૂથ	૩૦	૧૬.૬૬૬	૩.૮૦૮	



VIDHYAYANA

ISSN 2454-8596

www.vidhyayanaejournal.org

An International Multidisciplinary Research e-Journal

સારણી-૧નું અર્થઘટન કરતા જણાય છે કે પ્રાયોગિક જૂથ અને નિયત્રિત જૂથની સરાસરી અનુક્રમે ૧૮.૮૦૦ અને ૧૬.૬૬૬ હતી. બને જૂથના પ્રમાણવિચલનો અનુક્રમે ૪.૫૨૬ અને ૩.૮૦૮ હતા. બને જૂથોની સરાસરીઓના તફાવતની સાર્થકતા ચકાસવા માટે ટી-મૂલ્યની ગણતરી કરવામા આવી હતી. ગણતરી બાદ મળેલ ટી-મૂલ્ય ૧.૮૫ હતું જે ૦.૦૫ કક્ષાના સાર્થકતા મૂલ્ય ૧.૬૬ કરતા ઓછું હતું. આથી આ બને જૂથોના શિક્ષક રચિત ઉત્તર કસોટીના પ્રાપ્તાકોની સરાસરી વચ્ચે સાર્થક તફાવત ન હતો.

પ્રાપ્ત અક્ષાસ્ત્રીય પરિણામો પરથી કહી શકાય કે વ્યાખ્યાન પદ્ધતિથી અધ્યાપન પામેલ નિયત્રિત જૂથની સરાસરી અને પાવર પોઇન્ટ પ્રેજન્ટેશન કાર્યક્રમ દ્વારા અધ્યાપન પામેલ પ્રાયોગિક જૂથના સરાસરી પ્રાપ્તાકો વચ્ચે તફાવત સાર્થક ન હતો. તેની પ્રસ્તુત અભ્યાસની શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર થતો નથી. આથી કહી શકાય કે વ્યાખ્યાન પદ્ધતિ અને પાવર પોઇન્ટ પ્રેજન્ટેશન કાર્યક્રમ દ્વારા અધ્યાપન કાર્ય અને પરપરાગત પદ્ધતિએ અધ્યાપન કાર્ય બને સમાન અસરકારક જોવા મળી હતી.

૧૬.૦ અભ્યાસના તારણો

પ્રસ્તુત અભ્યાસમા આ પ્રમાણે તારણ મળ્યું હતું.

પ્રસ્તુત અભ્યાસ અત્યારે બી.ડેડ્. અભ્યાસકર્મના બાલ્યાવસ્થા અને વિકાસ વિષયના ‘અભિસધાન’ એકમના અધ્યાપનના સદર્ભમા પાવર પોઇન્ટ પ્રેજન્ટેશન કાર્યક્રમ અને પરપરાગત પદ્ધતિ વચ્ચે સાર્થક તફાવત જોવા મળ્યો ન હતો. આથી પાવર પોઇન્ટ પ્રેજન્ટેશન કાર્યક્રમ દ્વારા અધ્યાપન કાર્ય અને પરપરાગત પદ્ધતિએ અધ્યાપન કાર્ય બને સમાન અસરકારક જોવા મળી હતી.

૧૭.૦ સદર્ભ સાહિત્ય

પ્રકાશિત સાહિત્ય

અભાસણા, એ. ડી. (૨૦૦૨). તમારા કમ્પ્યુટરને ઓળખો. શિક્ષણશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
ઉચાટ, ડી. એ. (૧૯૮૮). સશોધનનું સાંદોહન (પ્રથમ આવૃત્તિ). રાજકોટ : શિક્ષણશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.

....., (૨૦૦૮). શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમા સશોધનનું પદ્ધતિશાસ્ત્ર. અમદાવાદ : સાહિત્ય મુદ્રાશાલય પ્રા. લિ.

